

Corporate Relations Department BSE Limited, Phiroze Jeejeebhoy Towers Dalal Street, Mumbai - 400 001.

Ref: RCL:KPS:BSE:NEWS-IEPF-TRFR/24:

Date: 25th June, 2024

Dear Sir,

Sub: News Paper Cuttings of Notice to concerned Shareholders for Transfer of Equity Shares to Investor Education & Protection Fund (IEPF).

Scrip Code: 500360

As per disclosure under Regulation 30 and 47(1)(d) of SEBI {Listing Obligations and Disclosures Requirements} Regulations, 2015, please find enclosed herewith News Paper Cuttings of Notice to concerned Shareholders for intimation of transfer of Shares to Investor Education and Protection Fund (IEPF) A/c pursuant to Section 124(6) of the Companies Act, 2013 read with Rule 6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 published on 25th June 2024 in Business Standard- Ahmedabad edition and in Loksatta – Jansatta Vadodara edition.

You are requested to make a note of the same.

Thanking you,

Yours faithfully,
For RAPICUT CARBIDES LIMITED



Komal Soni
Company Secretary & Compliance Officer

Encl: As above



We hereby inform publicly that Bungalow No. 6, having Plot area admeasuring 411.37 Sq. Meters togetherwith construction thereon admeasuring 129.59 Sq. Meters of Mona Park Cooperative Housing Society Limited, Iying at situated Final Plot No. 87 and 88 of Town Planning Scheme No. 2 of Survey No. 473/1 and 473/2, Mouje: Vejalpur of Taluka: Vejalpur of District Ahmedabad was originally allotted to Sureshbhai Jayantilal Shah rhereafter, Sureshbhai Jayantilal Shah sold the said property to Kirtanlal Bapulal Trivedi vide Resolution dated 20.08.1972. Thereafter, Kirtanlal Bapulal Trivedi vide Resolution dated 20.08.1972. Thereafter, Kirtanlal Bapulal Trivedi vide Resolution Kirtanlal Fivedi and no other heirs had having an any objection regarding executed WILL. Thereafter, Urmilaben Kirtanlal Trivedi sold the said property came to the share of Urmilaben Kirtanlal Trivedi and no other heirs had having an any objection regarding executed WILL. Thereafter, Urmilaben Kirtanlal Trivedi sold the said property to Vinod Manubhai Shah by Sale Deed bearing No. 3198 dated 13.07.2004. Thereafter, Vinod Manubhai Shah sold the said property to Sanjay Jayantilal Thakkar has informed that he has lost (i) Original WILL bearing No. 1225 dated 27.01.1987 with RR and (ii) Original Sale Deed bearing No. 3198 dated 13.07.2004 with RR. Therefore, we hereby informing it publically and to all concern peoples that if any heirs of Kirtanlal Bapulal Trivedi having any objection about the WILL and for lost documents as mentioned above and if any person or if any other heirs have an any objection, inheritance then such objection should be raised with evidence in written within 7 days from the date of the publication of this notice. Pls. take note that if failed to object within 7 days then we will issue a No Objection certificate for this property.

LE EXPART ASSOCIATES - M. H. Bloch, Parveen F. Bloch, Plyush Shiyal, Pallavi PUBLIC NOTICE LE EXPART ASSOCIATES -M. H. Bloch, Parveen F. Bloch, Piyush Shiyal, Pallavi Kaushal Soni, Kazi Heenakausar M., Uzma M. Shaikh (Advocates) G-812, Titanium City Center, Prahladnagar Main Ro Place : Ahmedabad

Date: 21.06.2023

RACPC Navsari (Branch Code: 64135) PSBI Italva, Dist.Navsari (Guj) Mo .: E-mail - sbi.64135@sbi.co.in Italva, Dist.Navsari (Guj) Mo .:7575053707

Opp. Seema Hall, Ahmedabad, Mo. No. 9904022116

POSSESSION NOTICE

Whereas the undersigned being the Authorized Officer for State Bank of India, RACPC Navsari (64135), Italva Ta- Navsari Dist-Navsari (Guj) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated **06.04.2024** calling upon the borrower Mrs Diptiben Arunbhai Hariyani , Mr Karna Arunbhai Hariyani And Mrs. Urvashi Karna Hariyani to repay the amount mentioned in the notice being Rs.30,26,071.10 (Rupees Thirty lacs twenty six thousand seventy one and paise 10 only) as on 05.04.2024 with further interest incidental expenses, cost, charges etc. within 60 days from the date of receipt of the said notice

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers, guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on this 19th Day of June - 2024.

The borrower and guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property wil be subject to the charge of the State Bank of India, RACPC Navsari (64135) Tal- Navsari Dist- Navsari for an amount of Rs.30,26,071.10 (Rupees Thrity lacs twenty six thousand seventy one and paise 10 only) Plus Interest and further interest t

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All The Piece & Parcel of the Property situated at Prince Heights, Royal Palace and paradise, Tighra Gandevi Road, Navsari, Tal. & Dist. Navsari having revenue survey No.107, City Survey Tikka No.125 City Sruvey No.4786, T.P. Sceme No.03, final plat No.131, land admeasuring 3975.00 sq.mtrs. known as a PRINCE HEIGHTS, building construction thereupon known as ROYAL, PALACE And PARADISE paiki flat situated at PALACE apartment, 2nd floor Flat No.201, build up area admesuring 1166.12 sq.fts i.e 108.375 sq.mtrs standing in the name of Mrs Diptiben Arunbhai Hariyani and Mr Karna Arunbhai Hariyani. Boundaries: East By: Internal Road, West By: After Passage Flat No. 204, North By: After Margin Paradise Building, South By: Flat NO.202.

Date : 19.06.2024 Place : Navsari Authorised Officer, State Bank of India, Navsari.



Shop No.1 & 2, Surat Kadodara Road, Next to DGVCL office Tal-Palsana, Surat - 3943052 Ph. 02622-272230, 274275. mail: kadoda@bankofbaroda.com

Date: 10.06.2024

NOTICE TO BORROWER (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

Mr. Premchand Mangaram Kumawat (Applicant) & Mr.Kanaram Mangaram Kumawat (Co-Applicant)
Address: Flat No 310 Haridham Society, Punagam Nr.Archana School Surat,

Gujarat - 395010

Dear Sir/ Madam

Re: Credit facilities with our KADODARA Branch

We refer to our sanction letter no. Retail – 00000137328-LMS Dated 05.09.2019 for the advance account Mr. Premchand Mangaram Kumawat (applicant) & Mr Kanaram Mangaram Kumawat (Co-Applicant) Conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under

Nature and Type of facility	and Limit Type I		O/s as on 25.01.2024 Exclusive of interest	Unrealized Interest (from 25.01.2024 to 24.04.2024	Uncharged interest (From 24.04.2024 to 09.06.2024	Penal Interest @ 2% simple basis from 24-04-2024 to 09-06-2024	Total amount dues as of 10.06.2024
Term Loan - Baroda Home Loan (3706060 0001492)	0,00. 00	0% Above 1 yr MCLR per annum with monthly interest plus risk premium of 0.05%	Rs. 1323338.00	Rs. 29033.18	Rs. 13889.08	Rs. 3268.02	Rs. 1369528.38
Total	15,0 0,00.		Rs. 1323338.00	Rs. 29033.18	Rs. 13889.08	Rs. 3268.02	Rs. 1369528.38

You are also liable to pay further contractual rate of interest on the above amount w.e.f. 09.04.2024 till realization. Since the entire amount is overdue, you are also liable to pay penal interest of 2% p.a. on simple basis on the entire overdue amount. Please note that the Bank has calculated and claimed penal interest of 2% on simple basis. The interest calculation sheet is enclosed herewith

Security Agreement with brief description of securities

Description of Securities: All right title and interest in the property bearing Open Plot No. 220 admeasuring area 87.75 sq. yds. i.e. 73.36 sq. mts. (after KJP its New Block No. 130/A/220 admeasuring area 72.60 sq. mts.) of "Sai Kutir Residency" together with undivided proportionate share of Road & COP of underneath land admeasuring area 42.54 sq. mtrs, situated on the N.A. land bearing revenue Survey No. 99 & 100/1, Block No. 130/A of village: Bagumara, Sub District: Palsana, District: Surat. **Properties** stands in the name of MR. PREMCHAND MANGARAM KUMAWAT (APPLICANT) & MR KANARAM MANGARAM KUMAWAT (CO APPLICANT). Boundaries: East: Internal road Society, West: Plot No. 219, North: Plot No. 221, South: C.O.P.

Security Agreement: The above properties were mortgaged with Bank of Baroda on 12.02.2020 and the same was registered with sub registrar office Palsana Dist Surat on 13-02-2020 bearing Registration number 1838. CERSAI Security ID - 4000380151

- 1. The outstanding stated above includes further drawings and interest upto 11 04 2024
- 2. As you are aware, you have committed defaults in payment of interest and installments of above loans from 25.01.2024 and thereafter
- 3. Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 24.04.2024 in accordance with the Reserve Bank of India directives and guidelines. Inspite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.
- 4. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 13,69,528.38 (Rupees Thirteen Lakhs Sixty Nine Thousand Five Hundred Twenty Eight and Paise Thirty Eight) plus other charges & unapplied interest thereon as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the
- rights under sub-section (4) of section 13 of the said Act, which please note. 5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.
- 6. We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.
- 7. The Borrower's/Guarantors attention is invited to provisions of section 13(8) of the act, in respect of time available, to redeem, the secured assets
- 8. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums

Yours faithfully, Chief Manager Authorised Officer, Bank of Baroda Date - 10/06/2024

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.



Vapi-396195, (Guiarat).

APPENDIX IV **POSSESSION NOTICE** (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

Sr.	Name of the Borrower(s)/	Description of Secured Asset	Demand Notice	
No.	Co-Borrower(s) (Name of the Branch)	(Immovable Property)	Date & Amount	
1	(Loan Code No. 04300000104/ Vapi Branch) Sangeeta Nandkishor Upadhyay (Borrower) Nandkishor S Upadhay (Co-Borrower)	All that part & parcel of property bearing, 225 2 Paiki1 Paiki 10 Flat No 101 1st Floor Avkar Palace Near Sarigam Teen Rasta Vapi Sarigam Road Sarigam Dist Valsad , Valsad , Gujarat , 396191 Boundaries: East - Flat No. 102, West - Lift & Stair, North - Open Plot, South - Passage.	13-11-2023 ₹ 8,37,764/-	23-06-2024

Place : Gujarat Date : 25-06-2024 **Authorised Officer** Aadhar Housing Finance Limited

Franch Office: ICICI Bank Limited, 1st Floor, GeetPrabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat-395002.

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET [See proviso to Rule 8(6)] Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder;

No	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Borrower(s)/ Secured asset(s) Co-Borrowers/ With known Guarantors/ encumbrances.		Price Earnest Money Deposit	Time of Property Inspection	Time of E-Auction
(A	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Hansaben Raghavbhai Sardhara (Borrower)/ Chandresh Raghavbhai Sardhara (Co-Borrower) Loan A/c No. LBSUR00004350267/ LBSUR00005196681	Flat No. 102, First Floor, Shubh Residency, Building: B-2, Block No. 4, Survey, No. 5, Mouje Village- Pasodara, Reg. Sub Dist. Kamrej, Dist. Surat. Admeasuring An area- Super Built Up Area 86,40 SQMT, Built Up Area 51.84 SQMT	Rs. 13,54,634/- (as on June 21, 2024)	Rs. 12,39, 000/- Rs. 1,24, 000/-	July 16, 2024 10:00 AM To 11:00 AM	August 08, 2024 From 11:00 AM Onwards
2.	Pooja Sheshant Khant (Borrower)/ Sheshant Vipulbhai	Flat No. 801, 8th Floor, Om Regency, Building No. A/2 (As per Location), Building No. A (As Per Passing	Rs. 29,30,062/- (as on June	Rs. 22,08, 000/-	July 16, 2024 11:00 AM	August 08, 2024 From
	Khant (Co- Borrower) Loan A/c No. LBSUR00004147405	Plan), Final Plot No. 362, T.P. No. 35 (Kumbhariya- Saroli-Saniya), Block No. 6, R. Survey No. 3, Mouje Village Saniya Hemad, Sub Dist. Choryasi, Dist. Surat Admeasuring an area Built up area 71.51 SQMT	21, 2024)	Rs. 2,21, 000/-	To 12:00 Noon	11:00 AM Onwards
3.	Rakesh Dabhi (Borrower)/ Bhumika Rakeshkumar Dabhi	Shop No. 201, 2nd Floor, Building No. B, Shantiniketan Business Plaza, Sub Plot No. 2, Final Plot No. 330, T.P.	Rs. 13,47,847/- (as on June 21, 2024)	Rs. 21,65, 000/-	July 16, 2024 12:00 Noon To	August 08, 2024 From 11:30 AM
	(Co- Borrower) Loan A/c No. LBSUR00002444121	Scheme No. 66, Block No. 1075+1077, Mouje Village- Kosad, Sub. Dist. Adajan (Surat City), Dist. Surat Admeasuring an Area Super Built up area About 610 SQFT, Carpet Area 33.45 SQMT	21, 2024)	Rs. 2,17, 000/-	01:00 PM	Onwards
4.	Vignesh Hasmukhray Pansuriya (Borrower)/ Sonalben	Shop No. 1005, 1st Floor, Wing-A, (Shop No. E-2 Paiki, Building-E- As Per Sanctioned Plan), Mansarovar	Rs. 23,18,940/- (as on June	Rs. 25,12, 000/-	July 16, 2024 01:00 PM To	August 08, 2024 From 11:30 AM
	V Pansuriya (Co- Borrower) Loan A/c No. LBSUR00004006781	Plaza, R.S. No. 683, Block No. 550/A, Mouje Village- Kathor, Sub Dist. Kamrej, Dist. Surat. Admeasuring an area Super Built Up area 576.86 SQFT, Carpet area 31.08 SQMT	21, 2024)	Rs. 2,52, 000/-	02:00 PM	Onwards

The online auction will be conducted on the website https://disposalhub.com of our auction agency M/s NexXen Solutions Private Limited The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by by August 07, 2024 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule. The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002 on or before by August 07, 2024 before 04:30 PM Thereafter, they have to submit their offer through the website mentioned above on or before by August 07, 2024 before 05:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/ are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at ICICI Bank ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002 on or before by August 07, 2024 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Surat.

For any further clarifications with regards to inspection, terms and conditions of the e-auction or submission

For any further clarifications with regards to inspection, terms and conditions of the e-auction or submission of tenders, kindly contact ICICI Bank Employee Phone No. 7304914237/9425815565.

Please note that the Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited, 2. Augeo Assets Management Private Limited 3. Cardekho.com 4. Hecta Proptech Private Limited have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: June 25, 2024

Authorized Officer

शेन्ट बैंक होम फायनेन्स लिमिटेड **Cent Bank Home Finance Limited**

APPENDIX-IV-A [Rule 8(6)] **TENDER CUM AUCTION SALE NOTICE**

Auction Date: 10-07-2024 सेन्ट्रल बैंक ऑफ इण्डिया की अनुषंगी Subsidiary of Central Bank of India Reconstruction of Financial Assets and Enforce

of Security Interest Act 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of Cent Bank dome Finance Ltd. Secured Creditor, will be sold on "As is where is". "As is what is" and "Whatever there is" Basis on Date Mention Below for acovery of amount mentioned against property due to the Secured Creditor from the Borrower. The Reserve Price and Earnest Money Deposi description of the property are as mentioned in the table below

S. No.	Name of the Borrower/ Co-Borrower & Account no.	Details of the Property	Amount Outstanding as on date of demand notice (₹)	Date of Demand Notice / Possession	Reserve Price (₹) Earnest Money Deposit (₹) 10%			
1	Mrs. Ambudevi Bhemaram Prajapat,	Flat No. I-404, Tower-I, Fourth Floor, Vedant Vishram, Beside GEB Sub Station, Jambuva, Vadodara – 390014 Property Area:- 455 Sq.Ft	+ Interest and	15.01.2018	9,16,000/-			
	Mr. Bhemaram J Prajapat LAN: HL-01602300000160	Boundaries: East: Flat No. H-401 West: Common Stair Case North: Flat No. I-403 South: Internal Road	other charges etc	27.07.2022 (Physical)	91,600/-			
2	Mrs. Urmilaben Solanki and Mr. Mohanbhai Raijibhai	Flat no. 403,Tower H,Vedant Vishram,B/s GEB Sub station,Jambuva,Vadodara 390013	10,54,505/- + Interest and	12.04.2022	9,32,000/-			
	Solanki LAN: HL- 01602300000167	Property Area:- 455 Sq,Ft Boundaries: East: Internal 7.5 mtr Road West: Common Lift North: Building Margin South: Flat No.404 H Tower	other charges etc.	09.01.2023 (Physical)	93,200/-			
3	Mr. Pushpendra Prakeshrao Shinde and Mrs. Minaxi Pushpendra Shinde	Flat no 904,9th floor,Tower-Sneh,Shreem Galaxy, B/h Bright day school, Nr Sharnam Residency, Bhaily, Vadodara 391410 Property	33,97,918/- + Interest and other charges	16.01.2023	25,31,000/-			
	LAN: HL- 01603010000093	Area: 99.03 Sq.mtrs Super built up area Boundaries: East: Sneh Flat No-901 West: Road, Tennis Scot Area North: Swimming POOL After Road South: Sneh Flat No-903	etc.	29.04.2023 (Physical)	2,53,100/-			
4	Mr. Prembahadur Shrilal Gorkha and Ms. Madhu Prembahadur	Plot No. C-39, Avanti Park Society, Heavy Water Tank Road, Danteshwar, Vadodara-390004	17,05,420/- + Interest and	25.07.2023	18,83,000/-			
	Thapa, Mrs. Shakuntala P Thapa (Gorkha) LAN: HL- 01603010000037	Property Area:- 48.37 Sq.Mt Boundaries: East: Society's Road West: Plot No.32 North: Plot No.38 South: Plot No.40	other charges etc.	06.10.2023 (Physical)	1,88,300/-			
TEE	MS & CONDITIONS: (4) The Aug	tion is being hold on AC IS WHEDE IS" "AC I	S WHAT IS " and	"MUATEVED	THERE IS DASIS"			

IERMS & CONDITIONS:- (1) The Auction is being held on AS IS WHERE IS", "AS IS WHAT IS " and "WHATEVER THERE IS BASIS" 2) The secured asset will not be sold below the Reserve Price (3) The intending purchase/bidder should submit their bids in the prescribed ender form in a closed cover separately for each property, with The Earnest Money Deposit (EMD) amount (not below the 10% of Reserve Price) by means of Demand Draft drawn in favor of Cent Bank Home Finance Ltd payable at Vadodara on or before 10/07/2024 up to 3.00 Price) by means of Demand Draft drawn in favor of Cent Bank Home Finance Ltd payable at vacouara on or before INVITALE UP TO SUMP M at above address of Cent Bank Home Finance Ltd. Vadodara Branch (4) The sealed covers will be opened by the Authorized Officer at Vadodara Branch in the presence of eligible/ available Intending Bidders who have deposited EMD amount Through Demand Draft to participate in Auction sale on 10/07/2024 at 4.00 PM (5) To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the property under sale. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/chain/ effecting the property, prior to submitting their bid. The Auction advertisement does of property put on auction and claims/ rights/ dues/chain/ effecting the property, prior to submitting their bid. The Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorized Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues (6) It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of property put on auction will be permitted to interested bidders at sites on 20/07/2024 between 11.00 PM to 4.00 PM (7) The Earnest Money Deposit(EMD) of the successful bidder/highest bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidder/shall be refunded. The Earnest Money Deposit shall not bear any interest. The sale shall be confirmed in favor of the purchaser who has offered the highest sale price in his bid or tender to the Authorized Officer and shall be subject to confirmation by the Secured Creditor. The highest bid will be subject to approval of the secured creditor/Authorized Officer (8) The successful bidder shall have to deposit 25% of the sale price, (inclusive of EMD paid), on the same day or not later than next working day and the balance amount of purchase price payable i.e. 75% of the sale price will be paid to the Authorized Officer on or before 15th day of confirmation of sale or such extended period [as may be agreed upon in writing between the purchaser and the secured creditor, in terms of Rule 9(4). In case of default of payment within the period mentioned above all the amount deposited till then shall be forfeited including Earnest money and the property shall be resold and the defaulting purchaser shall forfeit all claim to the property or any part of the sum for which it may be subsequently sold (9) The purchaser shall bea t may be subsequently sold (9) The purchaser shall bear the applicable stamp duties/ additional stamp duty/transfer charges, fee etc. and als It may be subsequently sold (9) In e purchaser shall bear the applicable stamp duties/ additional stamp duty/transfer charges, fee etc. and also all the statutory/ non statutory dues, taxes, rates, assessment charges, fees etc. owing to anybody (10) The Authorized Officer is not boun to accept the highest offer and the Authorized Officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/ postponed cance the Auction without assigning any reason thereof (11) This is also a notice to the Borrower/Guarantor/Property owner of the aforesaid loan is respect of the sale of the above mentioned secured Asset (under SARFAESI Act 2002) (under Rule 8(6).

Place: Vadodara, Date: 24.06.2024 Authorised Officer, Cent Bank Home Finance Ltd In case of discrepancy between notices published in English and Gujarati, the contents of the notice published in English shall prevail

Branch : FF-122-123, Kanha Capital, Opp. Express Hotel, R.C. Dutt Road, Alkapuri, Vadodara – 390007 Phone No. 0265-2987378, 2390011 | www.cbhfl.com

Rapicut Carbides Limited



POSSESSION

NOTICE

Regd. office: 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat Email: investors@rapicutcarbides.com Website: www.rapicutcarbides.com

NOTICE TO SHAREHOLDERS

TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

Pursuant to provisions of Section 124 (6) of the Companies Act, 2013 read with Rule 6 of Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and amendments made thereto, inter-alia provide for transfer of all shares in respect of which dividend has not been claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund set up by the Central Government. The Company has communicated to concerned shareholders whose shares are liable to be transferred to IEPF, at their latest available address and uploaded details of such shareholders, along with their Names and their Folio No. / DP ID / Client ID on its website at www.rapicutcarbides.com/finance.htm. The said shares correspond to the unclaimed dividend for the Financial Year 2016-17. Shareholders may access the website to verify details of the shares liable to be transferred to IEPF.

Shareholders concerned may make an application to the Company/Registrar by 30th September, 2024 with a request for claiming the unpaid dividend for the financial year 2016-17 onwards so that shares would continue to be registered in their names. If no reply is received by 30th September, 2024, the Company will transfer the shares to the IEPF without any further notice by following due process as under:

- i) In case of shares held in Demat Mode: By transfer of shares directly to Demat Account of IEPF Authority with the help of Depository Participants.
- ii) In case of shares held in Physical Form: By issuing new Share Certificates and thereafter transferring the same to IEPF Authority and in such cases Original Share Certificates of these shareholders shall stand cancelled and will not exist.

Shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed from the IEPF Authority by filling Web based Form IEPF-5 as prescribed under the said Rules. For any query shareholders are requested to contact Secretarial Department of the Company at Tel: 07622002203 / 7573022016, Email Id: investors@rapicutcarbides.com or Company's Registrar and Transfer Agents, M/s Link Intime India Pvt. Ltd., Tel: 022 49186270, Email ID: rnt.helpdesk@linkintime.co.in / iepf.shares@linkintime.co.in

For Rapicut Carbides Limited Date: 25/06/2024 Komal Soni Place: Ankleshwar Company Secretary

HDFC Bank Ltd. - HDFC BANK

HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone: (079) 66307000

Whereas the Authorised Officer/s of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme c Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) under Securitisation And Reconstruction of Financial Assets an Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(

I.	60 da	s from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisation.						
Sr. No.		Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)		
ı	(a)	(b)	(c)	(d)	(e)	(f)		
	1	MR. HARDIK HIRENKUMAR SHAH (Borrower) MRS. NEHA HARDIKBHAI SHAH (Co-Borrower)	Rs. 1,47,190/- And Rs. 42,70,088/- Respectively as on 31-Oct., 2023*	29-Nov., 2023	22-June, 2024 Physical Possession	FLAT-803, 8TH FLOOR, SKY ONE-FLAT, PLOT TPS-2, S. NO. FP-5, BLOCK 105, NR. NILKANTH ORCHID, BEHIND STERLING CITY, NORTH BOPAL, AHMEDABAD-380058.		
	2	MR. HEMANT KUMAR SINGH (Borrower) MRS. SUMAN SINGH (Co-Borrower)	Rs. 37,865/- And Rs. 11,32,455/- Respectively as on 31-Aug., 2023*		23-June, 2024 Physical Possession	FLAT-D/406, 4TH FLOOR, BHAGVAT GREENS-BLOCK D + E, S. NO. 63/2, 63/5, FP-85 + 90, TP-57, NR. ARUTI TOWNSHIP, NAROL, AHMEDABAD-380001.		
	3	MR. RAJKUMAR MADHAVPRASAD JAISWAL (Borrower)	Rs. 10,94,648/- And Rs. 5,85,165/- Respectively as on	08-Nov., 2023	2024 Physical	UNIT NO74, R. S. NO. 193/1, GAJANAND PARK COLONY, MEGHPAR BORICHI, ANJAR, KUTCH-370110.		

tal expenses, costs, charges etc incurred till the date of payment and / or realis

30-Sep., 2023*

However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned thereinabove have failed to repay the amounts due, notice is ereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the uthorized Officer/s of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of malgamation approved by Horble NCIT-Mumbai vide order dated 17th March 2023) have taken possession of the immovable property (lest) / secures set(s) described herein above in exercise of powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the

lates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned no odeal with the aforesaid immovable Property (ies) / Secured Asset(s) and any dealings with the said immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of the available to redeem the secured asset/s.

valiable to redeem the secured asset/s. Copies of the Panchnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal sentative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours. Date: 24-06-2024 For, HDFC Bank Ltd.

Place: Ahmedabad

Authorised Officer Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013 CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

T- HDFC BANK

HDFC Bank Ltd.

For, HDFC Bank Ltd

Branch: HDFC Bank Limited, Trident, Race Course, Vadodara-390007, Tel.: 079-64807999

/hereas the Authorised Officer/s of **HDFC Bank Ltd.**, (erstwhile HDFC Limited having amalgamated with **HDFC Bank Limited** by virtue of a Scheme of malgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023)under Securitization And Reconstruction of Financial Assets and inforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement, ules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative, in the said profession and the said profession and the said profession within the said profession. pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 0 days from the date of payment and / or realization.

Name of Borrower(s)/ Outstanding Date of Date of Description of Immovable Demand Possession Legal Heir(s)/ Legal Property(ies)/ Secured Asset(s) Representative(s) Notice Physical/ (d) (e) MR. NILESH V. SHIRKE UNIT-101, 1ST FLOOR, SHREE Rs. 6,84,527/-05-Oct. 22-June, SIDDHESHWAR HEIGHTS (Borrower) 2023 MRS. PADMINIBEN V. TOWER-H. S. NO. FP-4. BLOCK-607/1 Rs. 13,76,365/-**Physical** Respectively NR. KANHA CITY AND SANSKRUTI SHIRKE (Co-Borrower) Possessior RESIDENCY, AJWA CHOWKDI, as on 31-Aug., 2023* NEW KARELIBAUG, 168041-631909818 & VADODARA-390022. 620329641 MR. ANWARUL ISLAM A/36, JALDHARA TENAMENTS. Rs. 9.17.958/-13-Nov. 23-June. R. S. NO.70/P, MAHESHWARI-SULAMANI (Borrower) 2023 2024 las on 30-Sep., 2023 **Physical** KARODIA ROAD, NR. PAYAL SOCIETY, BAJWA ossessio 167081-610912880 VADODARA-391310

ith further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisat

Furthermore, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above have failed to repay the amount ue, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and to the public general that the Authorised Officer/s of **HDFC** have taken possession of the immovable property (ies) / secured asset(s) described herein pove in exercise of powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the date

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and the public in general are hereb utioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies)

cured Asset(s) will be subject to the mortgage of HDFC. rower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in

spect of time available to redeem the secured asset/s. Copies of the Panchnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s)/Legal Heir(s)/Lega resentative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hour Further, vide this Public Notice is issued in view of the fact that HDFC has not been able to communicate / establish contact.

resaid Borrower (s)/Legal heir(s)/Legal Representative(s) at his/her/their last known address as per HDFC's records At the time of taking over possession of the said immovable property (ies) / Secured Asset (s), the Authorised Officer of HDFC has draw an inventory of personal belongings and household goods lying therein, copy whereof can be collected from the under

In the circumstances, Notice is hereby given, to the said Borrower (s)/ Legal heir(s) / Legal Representative(s) to forthwith remove the ersonal belongings / household goods lying in the aforesaid immovable property (ies) / Secured Asset (s) within 10 (Ten) Days from the date ere of, failing which the Authorised Officer will have no other option but to remove the personal belongings/household goods and dispose off eal with it in the manner as may be deemed fit, entirely at the Borrower (s) / Legal heir(s) / Legal Representative(s) risk as to cost and nces, in which event, no claim will be entertained in this regard in future

Date: 24-06-2024 Place : Vadodara

Authorised Officer Regd. Office: HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં

કેનેડામાં સેંકડો ભારતીય પાર્ટ ટાઇમ

सोडसता ^{कु} जनसत्ता वडोहरा

ગ્રામદીઠ રૂ.૬૩ વધી રૂ.૭,૦૬૦ના

ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની

જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. દર

વધી રૂ.૭૧,૪૯૧ના સ્તરે પહોંચ્યો

ર્વ કિલોદીઠ રૂ.૮૯,૧૭૬ના ભાવે

કોમોડિટી વાયદાઓમાં રૂ.૨,૩૨૬ કરોડ અને ઓપ્શન્સમાં રૂ. ૫,૨૯૨ કરોડનું ટર્નઓવર



સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી

રૂ.૭,૬૨૨.૪૨ કરોડનું ટર્નઓવર જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં

વાયદાનાં કામકાજનો હિસ્સો ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં

રૂ.૨,૩૨૬.૨૧ કરોડનો અને રૂ.૮૯,૪૫૫ અને નીચામાં

ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૫૨૯૨.૧૪ રૂ.૮૮,૯૦૯ ના મથાળે અથડાઈ,

કરોડનો હતો. કીમતી ધાતુઓના રૂ.૧૩૦ વધી રૂ.૮૯,૨૬૯ ના સ્તરે

વાયદાઓમાં સોનાના વાયદાઓમાં બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન

એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો કોન્ટ્રેક્ટ રૂ.૧૪ ઘટી રૂ.૮૮,૯૫૧

સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ

રૂ.૭૧,૭૧૬ના ભાવે ખૂલી, દિવસ રૂ.૯૪ વધી રૂ.૮૯,૦૨૭ બોલાઈ

દરમિયાન ઉપરમાં રૂ.૭૧,૭૬૩ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના

અને નીચામાં રૂ.૭૧,૬૪૬ ના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ

મથાળે અથડાઈ, રૂ.૧૧૬ વધી જૂન વાયદો રૂ.૮૪૬ના ભાવે

અગ્રણી કોમોડિટી

ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ

પર વિવિધ કોમોડિટી વાયદા,

ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં

નોંધાયું હતું, જેમાં કોમોડિટી

સોનાના ભાવમાં રૂ.૧૧૬ અને ચાંદીમાં ૧૩૦ની વૃદ્ધિ નોંધાઇ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.૧.૧૫ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ અને ક્રૂડ તે 🕶 ો વાયદાઓમાં

રૂ.૩૩.૩૬ કરોડનાં ૧,૧૫૧ લોટ

તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-

મિની વાયદાઓમાં રૂ.૧૨૯.૮૨

કરોડનાં ૬,૫૩૪ લોટ નાં કામ

થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં

એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-

મિની વાયદાઓમાં રૂ.૩૮.૩૪

કરોડનાં ૬૮૮ લોટ સીસુ અને

સીસુ-મિની વાયદાઓમાં રૂ.૧૪.૧૬

કરોડનાં ૨૩૦ લોટ તાંબાના

વાયદાઓમાં રૂ.૩૦૦.૦૧ કરોડનાં

૧,૪૧૬ લોટ અને જસત તથા

જસત-મિની વાયદાઓમાં રૂ.૯૭.૪૮

કરોડનાં ૧,૩૬૩ લોટના વેપાર

ખાંડી વાયદામાં રૂ..૨૮ કરોડનાં ૧

લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.ર.પ૮

કરોડનાં ૭૮ લોટનાં કામકાંજ થયાં

હતાં. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ

વાયદામાં રૂ.૪.૦૭ કરોડનાં ૪૪

લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન

વધી રૂ.૧૯૦ના ભાવ થયા હતા. રૂ.૨૨૪ના ભાવે ખૂલી, રૂ.૨.૧૦ જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.૦.૫૦ ઘટી ઘટી રૂ.૨૨૩.૮૦ અને નેચરલ રૂ. ૨૬૩ના ભાવ થયા હતા. મિની ગેસ-મિની જૂન વાયદો ૨.૧ ઘટી વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો ૧ કિલોદીઠ રૂ.૧.૨૦

૨૨૩.૮ બોલાઈ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં ઘટી રૂ.૨૩૨.૨૫ સીસુ-મિની જૂન એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.૦.૫૦ ઘટી રૂ.૧૮૮.૯૦ વાયદો સત્રની શરૂઆતમાં ૧ ખાંડીદીઠ જસત-મિની જૂન વાયદો રૂ.૦.૩૫ રૂ.૫૭,૮૦૦ના ભાવે ખૂલી, દિવસ ઘટી રૂ.૨૬૧.૯૫ બોલાઈ દરમિયાન ઉપરમાં રૂ.૫૭,૮૦૦

કોટન-ખાંડી, મેન્થા તેલ વધ્યાઃ નેચરલ ગેસ ઢીલુ બુલડેક્સ વાયદામાં રૂ.૪.૦७ કરોડનાં કામકાજ

જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં બેરલદીઠ રૂ.૬,૭૩૮ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન રૂ.૯૦૬.૫૦ બોલાયો હતો. ઉપરમાં રૂં.૬,૭૫૧ અને નીચામાં રૂ.૬,૭૦૦ ના મથાળે અથડાઈ, પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ રૂં.૧ વધી રૂ.૬,૭૪૭ બોલાયો વાયદાઓમાં રૂ.૬૩૪.૪૪ કરોડનાં રૂ.૭૧,૭૦૦ના ભાવે પહોંચ્યો હતો. ખૂલી, રૂ.૧.૯૦ ઘટી રૂ.૮૪૫.૩૦ હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ અને ચાદીના વિવિધ વાયદાઓમાં

રહૃાો હતો. એનર્જી સેગમેન્ટના અને નીચામાં રૂ.પ૭,૮૦૦ ના મથાળે વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ અથડાઈ, રૂ.૨૦ વધી રૂ.૫૭,૮૦૦ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧.૨૦ વધી

કામકાજની દષ્ટિએ એમસીએક્સ ગ્રામદીઠ રૂ.૭૧ વધી રૂ.પ૮,૨૨૮ - રૂ.૧.૨૦ ઘટી રૂ.૨૩૧.૫૦ તેમ બોલાઈ રહૃાો હતો. નેચરલ ગેસ હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ લોટના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ ઘટી રૂ.૧૩.૧૦ થયો હતો.

જૂન વાયદો ૧૮,૪૮૬ પોઈન્ટ ખૂલી, ઉપરમાં ૧૮,૫૧૯ અને નીચામાં ૧૮,૪૭૩ બોલાઈ, ૪૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૨૬ પોઈન્ટ વધી ૧૮,૫૧૯ પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. પ૨૯૨.૧૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ. ૬,૮૦૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કૌલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૧૩૭.૬૦ના ભાવે ખૂલી, દિવસ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન દરમિયાન ઉપરમાં રૂ.૧૪૪.૮૦ અને નીચામાં રૂ.૧૩૭.૩૦ ના મથાળે અથડાઈ, રૂ.૦.૧૦ વધી રૂ.૧૪૨.૩૦ થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.૨૪૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૧૩.૧૫ ખૂલી, ઉપરમાં રૂ.૧૩.૪૫ અને એા સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ જૈયારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ વાયદો રૂ.૩ે વધી રૂ.૬,૭૫૧ રૂ.૧,૦૯૬.૬૭ કરોડનાં વેપાર થયા ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં ૪૬૦ નીંચામાં રૂ.૧૨.૯૦ રહી, અંતે રૂ.૧ નજીકના ગોરા લોકો પણ અહીં દેશમાં નોકરીની તંગી વિશે જાણતા

પર વાયરલ થઈ રહેલો એક વીડિયો ટોરોન્ટોમાં ટિમ હોર્ટન્સ આઉટલેટની બહાર નોકરી શોધનારાઓની લાંબી કતાર દર્શાવે છે. લોકપ્રિય કોફી અને ફાસ્ટ-ફૂડ જોઈન્ટ ચેઈનની બહારની લાઈનમાં પાર્ટ-ટાઈમ જોબ માટે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી, નિશાતે, જે પોતે નોકરી મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વિદ્યાર્થીએ શેર કર્યું કે જો કે તે સમયના ૩૦ મિનિટ પહેલા જોબ બધા વિદ્યાર્થીઓ પહેલેથી જ કતારમાં ઉભા હતા. નિશાતે કહ્યું, "૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ જોબ ફેર માટે પહેલેથી જ બતાવ્યું હતું. લાંબી લાઇન જોઈને,

જોબ માટે વિદ્યાર્થીઓની લાગતી કતાર ટોરેન્ટો,તા.૨૪ ગયા હતા,'' વિડિયો શેર કરતાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ નિશાતે કહ્યું, ''ટિમ હોર્ટન્સ ઔર વિદેશમાં મળવા માટે કેનેડામાં સ્ટ્રગલ અભી બાકી હૈ મેરે દોસ્ત પાર્ટ-ટાઇમ નોકરી શોધવા માટે જોબ ફેર.''વિડિયોમાં, ભારતીય દોડાદોડી કરે છે, સોશિયલ મીડિયા વિદ્યાર્થીએ શેર કર્યું કે ધ ટિમ હોર્ટન્સ સ્ટાફે તેમના રિઝ્યુમ એકઠા કર્યા, તેમની ઉપલબ્ધતા વિશે પૂછપરછ કરી અને પછી

તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં

આવશે તેવી ખાતરી આપીને તેમને

વિદાય આપી. ત્યારપછી તેણે બીજા સ્ટોરમાં વિદ્યાર્થીઓ વચ્ચેની અપાર સ્પર્ધોને નોકરી માટે અરજી કરવા માટે હાઈલાઈટ કરી હતી.કેનેડામાં એક શહેરના જુદા જુદા ભાગમાં પ્રવાસ ઇન્સ્ટાગ્રામ યુઝર અને ભારતીય કર્યો. "મને ખબર નથી કે મને ક્યાં તો સ્ટોરમાં નોકરી મળશે. તેથી, શોધી રહ્યો હતો, તેણે સોશિયલ આ મારો દિવસ સંઘર્ષથી ભરેલો હતો.'' તેણે એમ પણ કહ્યું કે આ શેર કર્યો જેમાં આઉટલેટની બહાર અન્ય નોકરી માટે અરજી કરી રહી ધસારો જોવા મળ્યો. ભારતીય છે તે તેના સ્થાનથી ખૂબ દૂર છે. આ વીડિયો કેનેડામાં નોકેરીની કટોકટી અને વધતી બેરોજગારીને દર્શાવે છે. ફેરમાં પહોંચી ગયો હતો, ઘણા ટિપ્પણી વિભાગમાં, ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું કે તેઓ કેનેડામાં નોકરી શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમને કોઈ નસીબ મળ્યું નથી. કેટલાક નેટીઝન્સે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું વિદેશી વિદ્યાર્થીઓ

એચઆર ઈએચએસ કોન્ફરન્સ ૨.૦નું આયોજન

કંપનીના સર્વાંગીવિકાસ માટે એન્વાર્યમેન્ટ, હેલ્થ, સેફ્ટી પર ધ્યાન આપવું જરૂરી



વડોદરા,તા.૨૪ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી હોટલ ખાતે સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશ્રલ્સ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસિસ, દિપક નાઇટ્રેટ, સુદ કેમી, વાસુ હેલ્થકેર, કેડેક કેમિકલ, પલ્વો કંપનીના ગ્રોથમાં પૂરેપૂરુ યોગદાન ઇન્ડસ્ટ્રી, સ્ટાન્ડર્ડ સિક્ચુરિટી અને રહેશે તે કંપની અને કર્મચારી હનુરામ ફૂડ્સના સહિયોગથી બંને માટે સારી વાત કહેવાશે. દ્રિતીય એચેઆર એન્વાર્યમેન્ટ, કોન્ફરન્સમાં ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીના હેલ્થ, સફ્ટા વિષયે કોન્ફરન્સનુ _ ડાયરક્ટર અતુલ શ્રોફ, મુનિ સેવા આયોજન કરાયું હતુ. જેમાં આશ્રામના ચેરપર્સન ડો. વિક્રમ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રુબામીનના સિનિયર કન્સલ્ટન્ટ રહેલા વડોદરાના સાંસદ અને મિહિર પટેલ, નવીન ફ્લોરાઈનના એચઆર પ્રોફેશનલ્સ એવા સિનિયર ડિરેક્ટર, ઇએચએસ હેમાંગ જોશીનું

સાંસદ હેમાંગ જોશીનો સત્કાર

જોઇએ. ઉપરાંત કર્મચારીઓની

હતું.કાર્યક્રમમાં

ઉપાસિથાત

નિષ્ણાંતો એ

એ કસૂરમાં

કરવું જોઇએ. આ સાથે મહત્વની વાત છે કે, કંપનીમાં સેફ્ટીના દરેક સાધન કાર્યરત હોવા જોઇએ અને કર્મચારીઓ તેને ચલાવી શકે તેની તાલીમ પણ આપવી જોઇએ. આમ કરવાથી કંપનીના દરેક કર્મચારીનું

સન્માન કરાયું **કાર્ચક્રમમાં વડોદરાના** મહેરા, ગુજરાત ફ્લોરો કેમના અેવી ઘી, ઇએચએસ ડો. કરવામાં આવ્યો સંજય ગાંધી,

જીએસપી ક્રોપના જણાવ્યું કે, દરેક કંપનીના એચઆર સીટીઓ ડો. હરેશ ચતુર્વેદી, અને ઇએચએસ ડિરેક્ટરની ઓપલના એચઆર હેડ અમિત જવાબદારી છે કે તેઓએ કંપનીમાં કૌલ, એચઆર અને મેનેજમેન્ટ એન્વાર્યમેન્ટ, હેલ્થ અને સેફ્ટી એડવાઈઝર રાકેશ છાબરા અને જેવા મુખ્ય વિષય પર ધ્યાન ઝાયલમ વોટર સોલુશન્સના આપવું જોઇએ. આમ કરવાથી જ એચઆર ડિરેક્ટર રીટા નાયરે કંપનીઓ સર્વાંગીક વિકાસ શક્ય એચઆર, એન્વાર્યમેન્ટ, હેલ્થ બનશે. જે માટે સમયાંતરે કંપનીમાં અને સેફ્ટીના વિવિધ વિષય પર્યાવરણ સબંધીત જાગૃતિ આવે 🛮 ઉપર ૪૦૦ થી વધારે એચઆર તેવા કાર્યક્રમો અને સ્પર્ધા સાથે અને ઇએચએસના પ્રાફેશનલ્સ, એક્સપર્ટ ટોકનું આયોજન કરવું કન્સલ્ટન્ટ્સ અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી તેમ હેલ્થ સારી છે કે નહીં તેની એસએચઆરપીના જાણકારી મેળવવા માટે સમયાંતરે મેમ્બર્સ સીમા નકુમ અને મયુર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન 🛮 ડોડે જણાવ્યું હતું.

સેબી દ્વારા ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર શંકાના આધારે દિલ્હી અને હૈદરાબાદમાં જપ્તીની કાર્યવાહી

મુંબઈ,તા.૨૪ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સંદીપ ટંડનની માલિકીના ક્વોન્ટ મ્યુચ્યુએલ ફંડ પર ફ્રન્ટ-રનિંગની શંકાના આધારે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી અને હૈદરાબાદમાં સર્ચ અને જપ્તી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદ, જપ્તી કામગીરીના અહેવાલોના જવાબમાં, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે એક નિવેદન બહાર પાડ્યું છે. ફંડે ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડ સાથેની પારદર્શિતા અને સહકાર જાળવવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. અમે તમામ જરૂરી સહાય પૂરી પાડીશું અને સેબીને નિયમિતપણે અને જરૂરિયાત મુજબ ડેટા આપવાનું ચાલુ રાખીશું. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે તેના રોકાણકારોને ૮૦ લાખથી વધુ ફોલિયો અને રૂ. ૩,૦૦૦ કરોડના છેંસ્ સાથે તેના પ્રાથમિક લક્ષ્યની ખાતરી આપી છે, તે રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્રન્ટ-રનિંગ પ્રવૃ ત્તિઓની શંકાના આધારે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર સર્ચ અને જપ્તી કામગીરી હાથ ધરી હતી.

ભારતી એરટેલ ભારતની સૌથી મોટી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશન કંપની ઇન્ડસ તો, ભારતી એરટેલ ટાવર કંપનીમાં પર ટકા હિસ્સો નિયંત્રિત કરશે.વોડાફોને

નવી દિલ્હી,તા.૨૪

૧૮ ટકા ઇક્વિટી વેચી હતી . બ્લોક ડીલ પછી, વોડાફોન પાસે ઇન્ડસ ટાવર્સમાં ૩.૧ ટકા શેરહોલ્ડિંગ હતું. ભારતી

પ્લાનના ભાગરૂપે, તેના ઉચ્ચ-વૃદ્ધિવાળા 🛮 દ્રટંક્રિમાં ૨૪ ટકા હિસ્સો ધરાવે છે, જે તેણે ડેટા સેન્ટર બિઝનેસ દ્રટંક્રિને ઇન્ડસ ૨૦૨૦માં પસંદ કરી હતી.ટેલિકોમ સેક્ટર ટાવર્સમાં મર્જ કરવાની પણ યોજના ધરાવે ટેરિફમાં વધારાની શ્રેણીને જુએ છે અને છે. ઇન્ડસ ટાવર્સને આગામી હરાજી માટે ઈન્ડસ ટાવર્સ ભારતની સૌથી મોટી કંપની રોકડની જરૂર પડશે. જ્યારે ડીલમાંથી છે. ટાવર કંપની, તેઓ ઉદ્યોગમાં સેવા મળેલા ભંડોળ દ્રટંિક માટે વિસ્તરણ અને પ્રદાતાઓના સ્વાસ્થ્યને સુધારવામાં મોટી વૃદ્ધિને આગળ ધપાવી શકે છે. ઇન્ડસ સોદો પાર પડશે તો ભારતી એરટેલ પર આવકનો મોટો હિસ્સો વાપરશે.બિઝનેસનું ગયા સપ્તાહે લગભગ રૂપિયા ૧૫,૩૦૦ ટકા હિસ્સા સાથે ઇન્ડસ ટાવર્સમાં બહુમતી વિલીનીકરણ કાર્લાઈલને એક્ઝિટ આપર્શે કરોડમાં બ્લોક ડીલમાં ઇન્ડસ ટાવર્સમાં શેરહોલ્ડર હશે. ભારતી એરટેલ તેના મેગા , જે અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ છે જે

શું થઈ રહ્યું છે તે વિચારીને ચોંકી ન હતા.

વોડાફોન સાથે વાટાઘાટો

ભારતી એરટેલની

ભૂમિકા ભજવશે, અહેવાલ મુજબ.ભારતી એરટેલનો શેર ૨૪ જૂને ૦.૪૨ ટકા વધીને રૂ.૧,૪૧૯.૨૦ પર બંધ થયો હતો. વોડાફોન ગ્રૂપ ઇન્ડસ ટાવર્સમાં તેનો સંપૂર્ણ ૨.૩ બિલિયન ડોલરનો હિસ્સો વેચવા માટે વિચારી રહ્યું હતું તેના ભારે દેવું ચૂકવવા વ્યૂહાત્મક પગલાના ભાગરૂપે, રોઇટર્સે

એરટેલે બ્લોક ડીલમાં ઇન્ડસ ટાવર્સમાં ટાવર્સે સૂચવ્યું છે કે વોડાફોનની કુલ બાકી ટાવર્સમાં વધારાનો ૩ ટકા હિસ્સો લેવા માટે વોડાફોન પીએલસી સાથે વાટાઘાટો લેશી લગભગ રૂપિયા ૫,૪૦૦ કરોડ ૧ ટકાનો વધારાનો હિસ્સો ખરીદ્યો હતો કરી રહી છે. જો વાટાઘાટો ફળીભૂત થશે અને ટાવર કંપનીમાં તેનું હોલ્ડિંગ ૪૯ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટકાની નજીક લઈ લીધું હતું. જો પ્રસ્તાવિત વોડાફોન આ લેણાંની ચૂકવણી માટે સોદાની

ભારતની સૌથી મોટી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશન કંપની ઇન્ડસ ટાવર્સમાં બહુમતી હિસ્સો લેવા માટે 🤇

હિંડનબર્ગ પર અદાણી પહેલીવાર બોલ્યાઃ અમને બદનામ કરવાનું કાવતરું નવી દિલ્હી.તા.૨૪

સોમવારે પોતાનો ૬૨મો જન્મ દિવસ ઉજવ્યો વર્ષ સુધી કામ કર્યું. આ પછી ૨૦ વર્ષની

વરસાદથી બચવા માટે શખ્સની વ્યવસ્થા જોઈને આનંદ મહિન્દ્રા ઉત્સાહિત બન્યા

નવી દિલ્હી,તા.૨૪ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ક્રિએટિવ અને સારા વિડીયો શેર કરતા રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ શરમાતા નથી. આનંદ મહિન્દ્રા અવારનવાર ફની વીડિયો શેર કરે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ દસ્તક આપી રહ્યું છે. આ દરમિયાન આનંદ મહિન્દ્રા પણ વરસાદથી બચવા માટે એક વ્યક્તિની વ્યવસ્થા જોઈને પ્રભાવિત થઈ ગયા હતા, જેમાં આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક વ્યક્તિ છત્રી પકડીને વરસાદમાં ચાલતો જોવા

ઉંમરે, તેમણે મુંબઈમાં પોતાનો હીરા દલાલીનો નિમિત્તે ગૌતમ અદાણીએ અદાણી જૂથની આ અમારી ૩૦મી વર્ષગાંઠ છે. તેથી અદાણી પાયાવિહોણા આરોપોનો સામનો કરવો પડ્યો દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વ્યવસાય શરૂ કર્યો. પહેલા જ વર્ષે તેમણે લાખો 🛮 વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. આ એન્ટરપ્રાઇઝિસની અદ્ભુત સફરની ઉજવણી હતો, જેણે અમારી દાયકાઓની મહેનત પર

રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું. એક સમય હતો સમય દરમિયાન તેણે હિંડનબર્ગ પરના હુંમલા કરવાનો અને પાછળ જોવાનો આ સારો સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા હતો. અમદાવાદના એક સામાન્ય પરિવારમાં જયારે ગૌતમ અદાણી સ્કૂટર ચલાવતા હતા. અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા. સમય છે. અમારો નિશ્ચય ગયા વર્ષ કરતાં વધુ અને પ્રતિષ્ઠા પર અભૂતપૂર્વ હુમલાનો સામનો જન્મેલા અદાણીએ ૧૨મા સુધીનો અભ્યાસ આજે તેની પાસે મ્સ્ઉ અને ફેરારી જેવી મોંઘી તેમણે કહ્યું કે તે રિપોર્ટ માત્ર અમને બદનામ સ્પષ્ટપણે દેખાતો હતો. આ અવસરે હિંડનબર્ગ કરીને, અમે વળતો સામનો કર્યો. આ સાથે અમે કર્યો છે. તેણે અભ્યાસ છોડી દીધો અને ૧૮ કાર છે. એક સમયે સ્કૂટર ચલાવનાર અદાણી કરવા માટે બનાવવામાં આવ્યો હતો આ રિસર્ચ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે અમને સાબિત કર્યું કે તમારું જૂથ જે પાયા પર સ્થાપિત વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. અહીં આજે અનેક ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની દરમિયાન તેમણે શેરધારકોને કહ્યું કે, આ વર્ષ એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા છે તેને કોઈપણ પડકાર નબળો પાડી શકે નહીં. તેમણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સ માટે બે 🔝 માલિકી ધરાવે છે. આજે, તેમના જન્મદિવસ 📉 ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હરણી વારસીયા રીંગ રોડ, વડોદરા.

દું પટેલ મહેબુબભાઈ અલીભાઈ

મારા પુત્ર વતી જાહેર કરું છું કે

મારા પુત્રનું નામ પટેલ મહંમદ મહેબૂબઅલી

માથી બદલીને

પટેલ મુહમ્મદ મહેબુબભાઈ

કરું છું. સરપંચ ફળિયું, તાંદલજા, વડોદરા.

पश्चिभ रेलवे – वडोहरा डिविञ्जन

<u>અને હોટસ્પોટની ઓળખ</u>

ટેન્ડર નં. EL/TRD/Tender/23-24/29R3

ભારતના રાષ્ટ્રપતિ માટે અને તેમના વર્ત

ડિવિઝનલ રેલ્વે મેનેજર (ઇલેક્ટ્રિકલ Tr.D) દ્વારા

નીચેના કામો માટે સીલબંધ ટેન્ડરો આમંત્રિત

કરવામાં આવ્યા છે. **ટેન્ડર નંબર :** EL/TRD

Tender/23-24/29R3**કામનું નામ :** વડોદર

મંડળ માં બે વર્ષના સમયગાળા માટે સુરત

વડોદરા - ગેરતપુર અને વડોદરા - ગોધરા સેક્શન માં થર્મો વિઝન કેમેરાનો ઉપયોગ કરીને 25kV AC

ટ્રેક્શન ઇન્સ્ટોલેશનની ખામી અને હોટસ્પોટર્ન

ઓળખ. કામની અંદાજિત કિંમત (રૂ.માં): 24,71,520/- બિડ સિક્યોરિટી (રૂ.માં)

49,400/- ટેન્ડર દસ્તાવેજોની કિંમત અને

પૂર્ણતાનો સમયગાળો : પૂર્ણતાનો સમયગાળ

24 મહિના **ટેન્ડર ટાઈમ ટેબલ:** ટેન્ડરની અંતિમ

તારીખ 22/07/ 2024 અને બંધ થવાનો સમય 15

00 કલાકે. <mark>વેબસાઇટ વિગતો અને માહિતીન</mark>ું

સ્થાન જ્યાં સંપૂર્ણ વિગતો: વેબ સાઈટ @

www.ireps.gov.in ડિવિઝનલ રેલ્વે મેનેજર

(ઈલેક્ટ્રિકલ Tr.D) પશ્ચિમ રેલ્વે, પ્રતાપનગર

अभने सार्धे इरोः f facebook.com/WesternRly

भा३ नाभ પ્રણવ મુકેશભાઇ માંડલીચા भारः नाभ હતુ બદલીને પ્રણવ મુકેશકુમાર સોની કરેલ છે. રાખેલ છે. બી ⁄ ૧૬, આકાશદીપ સોસાચટી,

દું ફરજાના મहેબૂબઅલી પટેલ થી બદલીને भारः नाभ પટેલ ફરઝાના મहેબૂબભાઈ કરેલ છે. સરપંચ ફળિયું, તાંદલજા,

भा३ नाभ

શિવાની જગદીશકુમાર ઠકકર

હતુ બદલીને

શિવાની જગદીશ ઠકકર

રાખેલ છે.

૨/બી, અરૂણોદય સોસાયટી,

અલકાપુરી, વડોદરા.

વડોદરા. નામ બદલ્યું છે મારું જુંનું નામ આસીફઈકબાલ સુલેમાનભાઈ

સોંદાગેર હતું અને નવું નામ આસીફ્ઈકબાલ સુલેમાનભાઇ સોદાગર કર્યું છે. સરનામુ - ૨૦૨, અફઝલ ચેમ્બર કાગડીવાડ, રાવપુરા - વડોદરા - ૩૯૦૦૦૧

Change of Name

I, Smt LALITA wife of No. 13830967P Ex Nk (Late) PARMAR MAHIJIBHAI presently residing at Vill/Post:

Chaklasi Teh: Nadiad Dist- Kheda State: Gujarat-387315. have changed my Name from LALÍTA To PARMAR LALITABEN MAHIJIBHAI

પી.આર.ઓ.નં .૧૩૮ /૨૪-૨૫.

vide Affidavit dated 20.06.2024 Sworn before Notary S,A,Jadav at Vadodara.

હું પટેલ મ**હેબૂબઅલી અલીભાઈ** થી બદલીને પટેલ મहેબૂબભાઈ અલીભાઈ

સરપંચ ફળિયું, તાંદલજા,

(Rameshvery) સુરેશસીંગ રાજપુત હતુ બદલીને રામેશ્વરી (Rameshhwari) અમીત ચૌઘરી રાખેલ છે. સી/૨૦૧, રૂષભ એટીક, વાસણા ભાચલી રોક, વકોદરા.

મારૂ નામ રામેશ્વરી

भा३ नाभ

પ્રીતિબાલા ચંન્દ્રકાંન્ત શાહ

હતુ બદલીને

પ્રીતિ દિનેશ શાહ

રાખેલ છે.

ડી-૬૦૨, સમન્વય સામિપ્ય,

હરણી, વડોદરા.

૧૧૯, જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, અંકલેશ્વર ૩૯૩૦૦૨, ગુજરાત



રેપીક૮ કર્બાઇડસુ લિમિટેડ

डोन : ७५२२००२२०३/७५७३०२२०१५ CIN: L28910GJ1977PLC002998 Website: www.ranicutcarbides.com Email: investors@rapicutcarbides.com

શેરઘારકો ને જાણવા જોગ નોટીસ ઇક્વિટી શેર, ઇન્વેસ્ટર એજચુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) ઓથોરીટીમાં તબદીલ કરવા બાબત

કંપનીઝ એકટ ૨૦૧૩ ની ૧૨૪ (૬) જોગવાઇઓ અને ઇન્વેસ્ટર એજચુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ ૨૦૧૬ અને થયેલ સુધારા ઓ અન્વયે જે શેરધારકોએ પોતાના શેર ઉપર સતત સાત વર્ષો કે તેથી વધું વર્ષો સુધી કિવિકન્ક વટાવેલ ન હોય કે દાવો કરેલ ન હોય તેવા શેરોને કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં તબદીલ (ટ્રાન્સફર) કરવાની જોગવાઇ છે. આ નિયમ અંતર્ગત કરાયેલી વિવિદ્ય જોગવાઇઓનું પાલન કરવાના हેતુથી જેમના શેર આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં તબદીલ કરવાપાત્ર થાય છે તે સંબંધિત બધાજ શેરધારકોને કંપનીએ પત્ર દ્વારા તેમના કંપનીમાં નોંધાયેલ સરનામે જાણ કરી છે. કંપનીએ આવા શેરધારકો ની વિગતો જેવી કે, નામ અને ફોલીઓ નં/ ડીપી આઇડી/કલાયન્ટ આઇડી અને આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં ટ્રાન્સફર થનાર શેરોની પુરી **વિગતો** કંપનીની વેબસાઇટ <u>www.rapicutcarbides.com/finance.htm</u> પર મૂકી છે. શેરધારકોને **વિનંતી છે કે આઇઇપીએ**ફ ઓથોરીટીની તરફેણમાં નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે દાવા વગરના ડીવીડન્ડ તબદીલ (ટ્રાન્સફર) કરવામાં આવનાર છે તેવા શેરોની વિગતોની ચકાસણી કંપનીની વેબસાઇટ પર કરી લેવી.

સંબંધિત શેરધારકોએ ૨૦૧૬-૧૭ અને તે પછીના વર્ષ માટે ના અનકલેઇમ્ડ્ ડીવીડન્ડ માટે ની અરજી તા ૩૦ મી સપ્ટેમ્બર, ર૦૨૪ સુધીમાં કંપની/રજીસ્ટ્રાર ને અરજી કરવી જેથી શેર તેમના નામ પર રજીસ્ટ્રર રહે. જો સંબંધિત શેરધારક દ્વારા તા ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં કોઇ જવાબ ન મળશે તો, કંપની નીચે મુજબની પ્રક્રિયાને અનુસરીને શેર આઇઇપીએફ માં વધુ કોઇ નોટીસ આપ્યા વગર ટ્રાન્સફર કરશે :

(i) **જે શેરધારકોના શેરો કિમેટ માં છે :** એવા શેરો કિપોઝિટરી પાર્ટીસિપન્ટની સહાય થી સીધા આઇઇપીએફ ઓથોરીટીના ડિમેટ ખાતામાં તબદીલ (ટ્રાન્સફર) કરવામાં આવશે.

(ii) જે શેરધારકોના શેરો ફીઝીકલ સ્વરૂપમાં છે : તેમના કંપની નવા શેર સર્ટિફિકેટો જારી કરશે અને ત્યારબાદ તે આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં તબદીલ (ટ્રાન્સફર) કરશે અને આવા કિસ્સામાં શેરધારકો ના અસલ શેર સર્ટિફિકેટો રદ કરવામાં આવશે અને ત્યાર પછી તેનું કોઇ અસ્તિત્વ રહેશે નહિ.

શેરધારકોએ નોંધ લેવી કે આઇઇપીએફ ઓથોરીટીની તરફેણમાં તબદીલ થયેલા શેરો અને તેના પર મળવાપાત્ર બઘા લાભ સહીત, જો હોય તો, નિયમો ને આધિન વેબ બેઝ ફોર્મ આઇઇપીએફ-પ ભરી તે માટે નિયત કરેલ પ્રક્રિયા નું પાલન કરીને આઇઇપીએફ ઓથોરીટી પાસે થી પરત મેળવી શકાશે.

જો શેરધારકોને ઉપરોક્ત બાબત અંગે કોઇપણ જાતની સમસ્યા/પ્રશ્નો હોય તો તેઓ સેક્રેટરિયલ ડીપાર્ટમેન્ટ ફોન : ७૬૨૨૦૦૨૨૦૩/७૫७૩૦૨૨૦૧૬, ઇ-મેઇલ : investors@rapicutcarbides.com અથવા કંપનીના ૨જીસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ મેસર્સ લીન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લિ. ફોન : ૦૨૨ ૪૯૧૮૬૨૭૦, ઇ-મેઇલ : rnt.helpdesk@linkintime.co.in/iepf.shares@linkintime.co.in નો સંપર્ક કરવો.

તારીખ : ૨૫/૦૬/૨૦૨૪

રેપીકટ કાર્બાઇડસ્ લિમિટેડ વતી કોમલ સોની (કંપની સેક્રેટરી)

વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે AI ની અસરઃ નોકરીઓ ગુમાવવાની સાથે નવી નોકરીઓ પણ બનાવશે

નવી દિલ્હી,તા.૨૪

સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. દુનિયામાં AIના વધી રહેલા ઉપયોગને કારણે લોકો હવે તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવી રહ્યા છે. ઘણા લોકો માને છે છે. હવે છેં એક્ઝિક્ચુટિવ્સે ઘણી બાબતો ડેલોઈટ એલએલપીના છેં વિભાગના ઉભો થયો હોય.

કહી છે કે AI નોકરીઓ પર શું અસર મેનેજિંગ ડિરેક્ટર ટંડને કહ્યું કે છેં કરશે. જ્યારે AI અમુક ભૂમિકાઓને દૂર પણ કરશે. ડેલોઈટના AI એક્ઝિક્યુટિવ રોહિત ટંડને જણાવ્યું હતું કે ભવિષ્ય માણસોનું સ્થાન લેતું નથી. ટંડને કહ્યું કે AI ભવિષ્યમાં ઘણી નોકરીઓ ખતમ કે તેઓ એક ક્રાંતિકારી યુગની કલ્પના

નોકરીઓ છીનવી લેશે નહીં, પરંતુ કરશે, તે વધુ નવી નોકરીઓનું સર્જન કેટલીક સરળ નોકરીઓ દૂર કરશે અને નવી ભૂમિકાઓ બનાવો. ટંડને કહ્યું, "આ કંઈક એવું હશે કે આપણે તેના એઆઈ-માનવ સહયોગનું છે, એઆઈ વિશે વાત કરીએ કે ન કરીએ, તે આપણા જીવનનો એક ભાગ બની જશે.'' તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી કે નવી કરી દેશે. કેટલાક લોકોનું કહેવું છે કે કરે છે જ્યાં ટેક્નોલોજી તેને બદલવાને ટેક્નોલોજી આવી હોય અને તેનાથી આનાથી ભવિષ્યમાં નોકરીઓ વધી શકે બદલે કર્મચારીઓને સશક્ત કરશે, નોકરીઓ છીનવાઈ જવાનો ખતરો



વડોદરા મહાનગરપાલિકા www.vmc.gov.in

દુકાનો ત્રણ(૩) વર્ષની મુદત માટે જાંઠેર ઠરાછ થી ફ્રાળવવા માટેની અરછઓ મંગાવવા પી.આર.ઓ.નં.૧૧૫/૨૪-૨૫ થી તા.૨૦.૬.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ થયેલ જોદરાતમાં અરજ સ્વીકારવા માટેની અંતિમ તા.ર૯.૬.૨૦૨૪ વાંચવી. બાકીની તમામ વિગતો ચથાવત રહેશે.









